



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૦૫/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૦૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૭ કેસ કરી, ૪૯ વ્યક્તિઓને ઝડપી, ૪૦૨ લીટર દેશી દારૂ અને ૦૫ બિયરટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૦૫ કેસ કરી ૨૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૪,૯૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૦૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૯૦૯/૧૯

ઓઢવ: કાર્તીક બાબુલાલ પટેલ (રહે.કીશ એવન્યુ-૧ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં નિરાંત ચોકડી પાસે વસ્રાલ રામોલ) એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૫/૧૯ બપોરના ૧/૦૦ થી તા.૨૭/૦૫/૧૯ કલાક ૮/૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન ઓઢવ તક્ષશીલા રોડ મીરાબાઇ સર્કલ પાસે કુવરબા હોસ્પિટલની બાજુમાં આવેલ “નિશા મેડીકલ” નામની પોતાની દવાની દુકાનના શટરના તાળા ચાવીથી ખોલી, અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી, ડ્રોઅરમાંથી અલગ-અલગ દવાઓ કુલ કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- તથા ટેબલના ડ્રોઅરમાંથી રોકડ રૂપિયા ૧૫૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.પલાસ ચલાવે છે.

શહેરકોટડા: નયનસિંહ રમણજી સોલંકી (રહે.મોટી સાળવી વાડ સ્વામિનારાયણ મંદિરનો ખાંચો સરસપુર) એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૫/૧૯ કલાક ૧/૦૦ થી સવારના ૮/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના દરવાજાની સ્ટોપર ખોલી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા ૪૮,૦૦૦/- તથા અગાશી પર પથારીમાં ઓશીકા નીચે મુકેલ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૪,૦૦૦/- તેમજ પાડોશી મોહનભાઇના ઘરમાંથી રોકડ રૂપિયા ૪,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧,૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એસ.પરમાર ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૯૧૦/૧૯

નરોડા: રામાભાઈ છગનભાઈ વણઝારા (રહે. દુધવાળી ગળી વિભાગ-૨ સંજયનગર સુર્યનગર પાસે નાના ચીલોડા) એ તા.૨૧/૦૫/૧૯ રાતના ૧૦/૦૦ વાગે સંજયનગર વિભાગ-૧ ના ગેટની સામે પોતાની ટાટા કંપનીની આઈવા (ડમ્પર) ગાડી નંબર જીજે ૦૨ વીવી ૭૩૨૯ કિમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૨૨/૦૫/૧૯ કલાક ૪/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ રામાભાઈ વણઝારાએ તા.૨૭/૫/૧૯ નારોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.કે.મારી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૯૧૧/૧૯

નરોડા: હિતેશભાઈ પ્રહલાદભાઈ પારેખ (ઉ.વ.૪૪) (રહે. શિવદર્શન સોસાયટી ગાયત્રી સ્કુલ પાસે નરોડા) એ અગમ્ય કારણસર તા.૨૭/૫/૧૯ કલાક ૩/૩૦ વાગ્યાના સુમારે ઝેરી ગોળીઓ ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી હિતેશભાઈ સોમાભાઈ ચલાવે છે.

મેઘાણીનગર: શીતલબહેન કિશોરભાઈ પટણી (ઉ.વ.૧૭) (રહે. પટણીનગર કલાપીનગર મેઘાણીનગર) એ અગમ્ય કારણસર તા.૨૭/૫/૧૯ કલાક ૯/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રીએ.એન.પરમાર ચલાવે છે.

દાણીલીમડા: પ્રકાશ કાંતિભાઈ પરમાર (ઉ.વ.૩૬) (રહે.સોનલપાર્ક વિભાગ-૨ દાણીલીમડા ગામ) એ અગમ્ય કારણસર તા.૨૬/૦૫/૧૯ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પ્રધાનજી ખેંગારજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.